


અમદાવાદ મહાનગર સેવા સંદાન

સરદાર પટેલ ભવન, દાણાપીઠ, અમદાવાદ



માહિતી (મેળવવાના) અધિકાર અધિનિયમ, ૨૦૦૫
કલમ નંબર ૪ (૧) અન્વયે

પ્રો-એક્ટિવ ડીસ્કલોઝર (૨૦૧૬-૧૭)

લાઈટ ખાતું, “સી” -બ્લોક, ૫ મો માળ, સરદાર પટેલ ભવન, દાણાપીઠ, અમદાવાદ -૩૮૦ ૦૦૧
ફોન નંબર : ૦૨૪૨૦૮૨૩

(૧) વ્યવસ્થાતંત્ર, કાર્યો અને ફરજો :-

લાઈટ વિભાગનાં ટેકનીકલ વિભાગ તથા વહીવટી વિભાગ દ્વારા મુખ્યત્વે નીચે મુજબની કામગીરી કરવામાં આવે છે.

સ્ટ્રીટલાઈટ પ્રોજેક્ટ મારફત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલીત વિસ્તારમાં હ્યાત સ્ટ્રીટલાઈટના ઓપરેશન અને મેઈન્ટેનાન્સ ઉપરાંત સક્ષમ સત્તાની મંજુરી મુજબ નવા સ્ટ્રીટલાઈટ સુવિધા ઉપલબ્ધ કરાવવાની કામગીરી ઉપરાંત હાઈમાસ્ટ લાઈટ સુવિધા ઈન્સ્ટોલેશન, ઓપરેશન અને મેઈન્ટેનાન્સની કામગીરી કરવામાં આવે છે.

લાઈટ વિભાગનાં એનજી એફિશીયન્સી સેલ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના એનજી કન્જીવિશન બાબતની કામગીરી કરવામાં આવે છે.


લાઈટ વિભાગ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના તમામ ઓડિસ બીલીંગ, હોસ્પિટલ, સ્મશાનગૃહ, સ્વીમીંગ પુલ, પબ્લિક ગાર્ડન અને સ્કુલ બીલીંગના ઈલેક્ટ્રીફિકેશન તેમજ તેના ઓપરેશન અને મેઈન્ટેનાન્સની કામગીરી કરવામાં આવે છે. લાઈટ ખાતા દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકનાં તમામ A.C., HVAC, પ્લાન્ટ્સ, લીઝ્ટસ, વોટર કુલર્સનાં ઓપરેશન અને મેઈન્ટેનાન્સની કામગીરી કરવામાં આવે છે.

લાઈટ ખાતાનાં વહીવટી વિભાગ દ્વારા મુખ્યત્વે વર્ગ ૧ થી ૪ સુધીના અધિકારી તથા કર્મચારીઓનાં પગાર, તેઓના સર્વીસ બુક સંબંધીત તેમજ તેઓની નિવૃત્તિ, સ્વૈ.નિવૃત્તિ, અવસાન, રીમુવ, અનફીટ થયા બાદ કર્મચારીઓને મળવાપત્ર લાભો ચુકવવાની કામગીરી જેવા વિવિધ કાર્યો તથા કાર્યલક્ષી સંબંધીત રેકૉર્ડ નીભાવણી અને તેને લગતી આનુષ્ઠાનિક કામગીરી તથા ટેકનીકલ વિભાગ દ્વારા કરવામાં આવનાર કામોનું સક્ષમ સત્તાની મંજુરી મુજબ બજેટ બુકીં તેમજ સક્ષમ સત્તાની મંજુરી મુજબ કોન્ટ્રાક્ટરનાં બીલનાં પેમેન્ટની કાર્યવાહી કરવામાં આવે છે.

ક્રમ	અધિકારીનું નામ	હોદ્દો	સંપર્ક નંબર
૧	શ્રી મહેન્દ્ર એચ. નિનામા	એડી. ચીફ એન્જિનીયર અને અપીલ અધિકારીશ્રી (લાઈટ)	M - ૯૮૭૪૫૧૪૩૮૧ O - ૦૭૯ ૨૫૩૮૧૮૧૧
૨	શ્રી ટિપક એચ. સુથાર	ડે. ચીફ એન્જિનીયર અને અપીલ અધિકારીશ્રી (સ્ટ્રીટલાઈટ/પ્રોજેક્ટ)	M - ૯૮૨૮૧૯૭૫૪૩ O - ૦૭૯ ૨૫૩૮૧૮૩૨
૩	શ્રી વાય. યુ. પ્રભાકર	ડે.સીટી એન્જિનીયર અને જાહેર માહિતી અધિકારીશ્રી (ઇલેક્ટ્રીકલ-૧)	M - ૯૮૨૭૫૫૪૮૦૨ O - ૦૭૯ ૨૫૩૮૧૮૧૧
૪	શ્રી એ.એ.મલ	ડે. સીટી એન્જિનીયર અને જાહેર માહિતી અધિકારીશ્રી (ઇલેક્ટ્રીકલ-૨)	M - ૯૮૭૬૦૧૭૫૬૫ O - ૦૭૯ ૨૫૩૮૧૮૧૧
૫	શ્રી એમ.યુ. પાવાગઢી	ડે. સીટી એન્જિનીયર અને જાહેર માહિતી અધિકારીશ્રી (ઇલેક્ટ્રીકલ-૩)	M - ૯૮૨૭૦૩૮૭૮૧ O - ૦૭૯ ૨૫૩૮૧૮૧૧
૬	શ્રી કંતિભાઈ ડાભી	આસી. મેનેજર અને જાહેર માહિતી અધિકારીશ્રી	M - ૯૮૨૭૫૫૪૮૦૮

Organization Chart - Light Department

Dear : 2016_17



(૨) અધિકારીઓ અને કર્મચારીઓનાં કાર્યોત્ત્થા ફરજો :

ક્રમ	જગાનું નામ	અધિકારી/કર્મચારી પાસેથી લેવામાં આવતી કામગીરી
૧	એડી. ચીફ એન્જિનીયર	અમદાવાદ ખુનિસિપલ કોર્પોરેશન હસ્તકના ઓફિસના મકાન બિલીંગ, હોસ્પિટલો વિગેરેની તમામ જગ્યાઓએ આવેલ ઈલે. મીડે.ને લગતી મેઈન્ટનન્સની કામગીરી તથા ટેન્ડરની કામગીરી
૨	ડે. ચીફ એન્જિનીયર	એસઆરએફડીસીઅલ તેમજ અન્ય પ્રોજેક્ટ, સ્ટ્રીટલાઇટ તથા નવા પ્રોજેક્ટની કામગીરી
૩	ડે. સીટી ઈજનેર	<p>દરેક વિભાગની વિઝિટ કરવી.</p> <p>ઓ એન્ડ એમ નો કોન્ટ્રાક્ટરમાં ટેન્ડર મુજબ મુજબ સ્ટાફ તથા કામગીરી થાય તે મુજબ ધ્યાન રાખવું.</p> <p>ઓગ્મેન્ટેશન કરવાની જરૂરીયાત છે કે કેમ તેની ટેકનીકલ ચકાસણી કરી યોગ્ય વહીવટી કામગીરી કરવી.</p> <p>કેપીટલ કામ તથા રેવન્યુ કામના ટેન્ડર સમયસર કરવા.</p> <p>એકસ્ટ્રા આઈટમ થતી હોઈ તો તેની ચકાસણી, અન્ય વિકલ્પ, સક્ષમ સત્તાની મંજુરીની કામગીરી.</p> <p>એન્જિનીશીયન્સીને લગતી કામગીરી.</p> <p>પાવર ફેક્ટર ઈમ્પ્રોવેન્ટ</p> <p>સ્ટાફની વ્યવસ્થા.</p> <p>બજેટને લગતી કામગીરી.</p> <p>પ્રોજેક્ટનું મોનીટરીંગ સમયસર પૂર્ણ થાય તે અંગે કામગીરી, કવોલીટી તથા મેજરમેન્ટની ચકાસણી.</p> <p>ઈલે. મીડે. સ્પેર્સ, સબ પંપની વધારાની સ્પેર વ્યવસ્થા રાખવી.</p> <p>હસ્તક હેઠળના સ્ટાફની કામગીરી પર દેખરેખ અને પરફોર્મન્સ ઈવેલ્યુઅશન આરટીઆઈ, એમપી-એમએલએ ના ગ્રશ્નના સમયસર જવાબ કરવા</p> <p>વિભાગની વહીવટી કામગીરી</p>
૪	આસી.સીટી ઈજનેર	<p>અમદાવાદ ખુનિસિપલ કોર્પોરેશન હસ્તકના તમામ ઈલે.મીડે. ઈક્વિપમેન્ટ બંધના રહે તેનું ધ્યાન રાખવું તથા ઈલે. મીડે. મશીનરીમાં બ્રેકડાઉન થયેલ હોય તો હાજર રહી સ્ટાફ/કોન્ટ્રાક્ટર પાસે વ્યવસ્થીત રીપેરીંગ કરાવવું.</p> <p>કલોરીનેશન પ્લાન્ટ (વકીગ/સ્પેર) ચાલુ કરીશનમાં રાખવા તથા કલોરીનેશનયુક્ત પાણી જ સપ્લાય થાય તે સુનિશ્ચિત કરવું.</p> <p>ખુનિસિપલ સ્નાનાગારમાં પાણીની શુદ્ધતા અંગે ધ્યાન રાખવું.</p> <p>પ્રીવેન્ટીલ મેઈન્ટનન્સ સમયસર થાય તેનું પ્લાનીંગ કરવું.</p> <p>ઓ એન્ડ એમ કોન્ટ્રાક્ટર રીપેરીંગના ટેન્ડર સમયસર કરવા તથા ટેન્ડર ટર્મસ મુજબ કામગીરી લેવી તથા સ્ટાફ છે કે નહીં તેનું ચેકીંગ કરવું.</p> <p>પ્રોજેક્ટના કામના ઓગ્મેન્ટેશનના કેપીટલ કામોના, રેવન્યુ કામોના ટેન્ડર સમયસર કરવા તથા ટેન્ડર સ્પેસીફીકેશન મુજબ કામગીરી થાય તે સુનિશ્ચિત કરવું, પાવર પ્રોક્યોરમેન્ટની સમયબદ્ધ કામગીરી કરવી.</p> <p>કેપીટલ તેમજ રેવન્યુ કામોની એમ.બી. રેકોડીંગ, મેજરમેન્ટ તથા કવોલીટી ચકાસણીની કામગીરી.,,</p> <p>પાવર ફેક્ટર ઈમ્પ્રોવેન્ટની કામગીરી.</p> <p>એન્જિનીશીયનું દર માસે સ્કુટીની કરવું તથા એન્જિની વપરાશ વધ અંગે જરૂરી ચકાસણી કરી તાકીદે પગલાં લેવાં.</p> <p>ઝોનલ એક્ટીવીટી, હાલ્સ, લીફ્ટ્સ, એ.સી. ફંક્શનસ, એએમ્સી મેટ, સોલર, ઈવેન્ટ્સ સ્પેશીયલ, એસઆરએફડીસીએલ તથા વરસાદની ગુતુમાં અન્ડરપાસમાં પાણી ભરાય તો તે માટે નિકાલની કામગીરી સેન્ટ્રા મારફતે કરાવવી.</p>

૫	આસી. ઈજનેર	કોઈપણ ઈલે.-મીકે. ઈકવીપમેન્ટ બંધના રહે તેનું ધ્યાન રાખવું. ઇલે.મીકે. મશીનરીમાં બ્રેકડાઉન થયેલ હોય તો હાજર રહી સ્ટાફ/કોન્ટ્રાક્ટર પાસે વ્યવસ્થીત રીપેરીગ કરાવવું. પ્રીવેન્ટીવ મેઈન્ટેનન્સ સમયસર થાય તેનું ખાનીગ કરવું. કોન્ટ્રાક્ટ ટેન્ડર સમયસર કરવા તથા ટેન્ડર ટર્મસ મુજબ કામગીરી લેવી તથા સ્ટાફ છે કે નહી તેનું ચેકીગ કરવું. ટેન્ડરમાં કેપીટલ/રેવન્યુ કામના એમ.બી. રેકોડીગ કરવું તેમજ મેઝરમેન્ટ ચેક કરવું. પ્રોજેક્ટ/ઓગમેન્ટેશનના કામમાં ઈરેક્શન સમયે ટેકનીકલ ચકાસણી કરવી. સ્ટાફ સંબંધી વહીવટી કામગીરી કરવી. એનજી એફિશીયન્સીને લગતી કામગીરી. એનજી બીલનું દર માસે સ્કુટીની કરવું તથા એનજી વપરાશ વધ અંગે જરૂરી ચકાસણી કરી તાકીદ પગલાં લેવાં જોનલ એક્ટીવીટી, ડાલ્સ, લીફ્ટ્સ, એ.સી. ફંક્શનસ, એએમ્સી મેટ, સોલર, ઈવેન્ટ્સ સ્પેશીયલ, એસઆરએફડીસીએલની કામગીરી
૬	ટેક.સુપરવાઈઝર	લેખીત રીપોર્ટ એ.ઇ./એ.સી.ઇ.ને દરરોજ આપવા, ડાયરી મેઈન્ટેઇન કરવી, કોઈપણ પ્રોબ્લેમ હોય તો એ.ઇ./એ.સી.ઇ. અથવા એ.સી.ઇ.ને જાણ કરવી.
૭	સ્ટ્રીટલાઈટ ઈસ્પે.	સ્ટ્રીટલાઈટ બંધ ન રહે તેનું ધ્યાન રાખવું તથા સમયસર જરૂરીયાત મુજબની કામગીરી કરાવવી.
૮	લીફ્ટમેન	સમયસર લીફ્ટ ચલાવવાની કામગીરી.
૯	ઇલેક્ટ્રીશયન	ઓવરઓલ એસઆરએફડીસીઅલ, પ્રોજેક્ટ મોસ્ટ ઓફ આઈઅમ્પી પ્લેસીસ, મઈન્ટેન્સ ઓફિસ બીલીયસુની કામગીરી
૧૦	ટેલી. ઓપરેટર	બહારથી આવતા તથા આંતરીક ખાતાકીય તમામ ફોન સંબંધીત અધિકારીશ્રી સુધી સંપર્ક કરી આપવા તથા તેને આનુસંગીક રજીસ્ટરો બનાવવા તથા નિયમીત અપડેટ કરવા
૧૧	રીસે.કમ ટેલી.ઓપરેટર	બહારથી આવતા તથા આંતરીક ખાતાકીય તમામ ફોન સંબંધીત અધિકારીશ્રી સુધી સંપર્ક કરી આપવા તથા તેને આનુસંગીક રજીસ્ટરો બનાવવા તથા નિયમીત અપડેટ કરવા
૧૨	આસી. મેનેજર	જુદા જુદા ખાતાઓની વહેચણી કરેલ હોઈ લાઈટ(સ્ટ્રીટલાઈટ) તથા પ્રોજેક્ટને લગતાં વિષયોની કામગીરી, ઇભ્રેશ કેશ, પાર્ટી પેમેન્ટની તમામ કામગીરી, ઇએમ્સી, પેમેન્ટ પહોંચ, સ્ટ્રીટલાઈટના બીલોને લગતી તમામ કામગીરી
૧૩	ઓફિસ સુપ્રીટેન્ન્ટ	આસી.મેનેજરશ્રીની સુચના અનુસાર તમામ કામગીરી
૧૪	એકાઉન્ટન્ટ	ખાતાની નાણાંકીય તમામ કામગીરીનું સંચાલન
૧૫	છેડ કલાર્ક	ઓફિસ સુપ્રી.ની સુચના અનુસાર વહીવટી કામગીરી
૧૬	સીની. કલાર્ક	જુદા જુદા ખાતાઓની વહેચણી કરેલ હોઈ લાઈટ(સ્ટ્રીટલાઈટ) તથા પ્રોજેક્ટને લગતાં વિષયોની કામગીરી, ઇભ્રેશ કેશ, પાર્ટી પેમેન્ટની તમામ કામગીરી, ઇએમ્સી, પેમેન્ટ પહોંચ, સ્ટ્રીટલાઈટના બીલોને લગતી તમામ કામગીરી
૧૭	જુની.કલાર્ક	બજેટ બુક, ઠરાવ, બીલ કલાર્ક, રીએભ્સમેન્ટ, સર્વિસ બુક મેઈન્ટેનન્સ, કર્મચારી/અધિકારી નિવૃત્તિ તથા સ્વ.નિવૃત્તિની કામગીરી, પોસ્ટેજ, આઈટવર્ક-ઇનવર્ક ની કામગીરી.
૧૮	પટાવાળા	ઇનડોર પટાવાળા - ખાતાકીય પટાવાળા તરીકેની કામગીરી આઉટડોર પટાવાળા - બહારના ખાતાને લગતી ટપાલો આપવા જવાની કામગીરી, તથા ખાતાકીય પત્રો પોસ્ટેજ ની કામગીરી
૧૯	સ્ટોર કિપર	સ્ટોરને આનુસંગીક તમામ કામગીરી
૨૦	સ્ટોર સુપરવાઈઝર	સ્ટોરને આનુસંગીક તમામ કામગીરી
૨૧	ટાઈપીસ્ટ કમ કલાર્ક	ખાતાકીય પત્રોની ટાઈપીગની કામગીરી
૨૨	સ્ટેનોગ્રાફર	અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ખાતાકીય પત્રોને લગતી તમામ કામગીરી

૨૩	સીની. ચાર્જમેન	ગાર્ડન, ઇલેક્ટ્રીક સર્વિસ, સોલર પ્રોજેક્ટને લગતી કામગીરી.
૨૪	જુની. ચાર્જમેન	મશીનરીની મિકેનીકલ ઈક્વીપમેન્ટને પ્રિવેન્ટીવ, રૂટીન તથા બ્રેકડાઉન રીપેરીંગની કામગીરી કરાવવી તથા મિકેનીકલ ગેંગ સાથે તેમજ ફીટર, ટર્નર, ગેંગમજુર વિગેરેને મિકેનીકલ માર્ગદર્શન કરી તેઓ સાથે કો-ઓર્ડિનેશન કરી કામગીરી કરાવવી.
૨૫	મીટર ઈસ્પેક્ટર	મીટરને લગતી તમામ કામગીરી
૨૬	રેઝિઝરેશન મીકેનીક	રેઝિઝરેશનને લગતી તમામ મીકેનીકલની તથા સર્વિસ કરાવવાની કામગીરી
૨૭	સીની. રેઝિ.ફીટર	તમામ એરક્ષિશન, વોટરકુલર તથા ફીજને લગતી તમામ મેઈન્ટેનન્સ તથા સર્વિસને લગતી કામગીરી
૨૮	સુપ. કમ વર્કમેન	ઇલે. મીકે. સ્ટોર સંભાળવાની કામગીરી
૨૯	પીકઅપવાન ડ્રાઇવર	ખાતાની કામગીરી માટે હેવી, મિડીયમ હેવી, લાઈટ વ્હીકલને ખાતાના સ્ટાફ સાથે કામગીરી કરવા વાહનો ચલાવવાની કામગીરી તથા વાહનોને મેઈન્ટેઇન કરવાની જવાબદારી
૩૦	ડ્રાઇવર	ખાતાની કામગીરી માટે હેવી, મિડીયમ હેવી, લાઈટ વ્હીકલને ખાતાના સ્ટાફ સાથે કામગીરી કરવા વાહનો ચલાવવાની કામગીરી તથા વાહનોને મેઈન્ટેઇન કરવાની જવાબદારી
૩૧	રીક્ષા ડ્રાઇવર	ખાતાની કામગીરી માટે ખાતાના સ્ટાફ સાથે કામગીરી કરવા રીક્ષા ચલાવવાની કામગીરી તથા રીક્ષા મેઈન્ટેઇન કરવાની જવાબદારી
૩૨	પંપ અને વાયરમેન એટેન્ટ	પંપને લગતી કામગીરી.
૩૩	વાયરમેન	ઇલેક્ટ્રીકલ ઈક્વીપમેન્ટ તેમજ સંસ્થાના અન્ય વિભાગો વિગેરે રૂમોની લાઈટીંગ તથા જરૂરી વાયરીંગ કરવાની કામગીરી તથા ઇલેક્ટ્રીશિયનની સાથે ઇલેક્ટ્રીકલ ઈક્વીપમેન્ટની પ્રિવેન્ટીવ, રૂટીન તથા બ્રેકડાઉન રીપેરીંગની કામગીરી કરવી.
૩૪	મીકેનીક	રૂટીન તથા બ્રેકડાઉન રીપેરીંગની કામગીરી કરવાની તથા મિકેનીકલ ગેંગની કામગીરીની વહેંચણી તેમજ સીની. ચાર્જમેન, જુની ચાર્જમેન, ફીટર, ટર્નર, ગેંગ મજુર વિગેરેને ટેકનીકલ મિકેનીકલ માર્ગદર્શન કરી તેઓ સાથે કો-ઓર્ડિનેશન કરી કામગીરી કરાવવી.
૩૫	જુની. રેફરી. ફીટર	એરક્ષિશન, વોટરકુલર એન ફીજને લગતી તમામ મીકે. તથા મેઈન્ટેનન્સ સર્વિસને લગતી કામગીરી.
૩૬	ફીટર	સેન્ટ્રીફ્યુગલ પંપ મોટર સેટ તથા મિકેનીકલ મશીનરીનાં પ્રિવેન્ટીવ, રૂટીન તથા બ્રેકડાઉન રીપેરીંગ કરવાની કામગીરી તેમજ આસી.ફીટરને મિકેનીકલ માર્ગદર્શન કરી કામગીરી કરાવવી.
૩૭	પંપમેન	પંપિંગ સ્ટેશનમાં આવેલ પંપો ચાલુ બંધ કરવાની કામગીરી
૩૮	નાયક	ઇલે. મીકેનીકની કામગીરીની દેખરેખ રાખવાની કામગીરી
૩૯	આસી. મીકેનીક	પંપના મીકે. ને લગતી કામગીરી
૪૦	વાયરમેન હેલ્પર	ઇલેક્ટ્રીશિયન અને/અથવા વાયરમેન સાથે સંસ્થાના અન્ય વિભાગની તમામ ઇલેક્ટ્રીકલ ઈક્વીપમેન્ટનાં ઓપરેશનની કામગીરી તેઓની સાથે રહી કરવી.
૪૧	ફીટર હેલ્પર	મીકે. કામમાં ફીટરને જરૂરી હેલ્પ કરવાની કામગીરી
૪૨	ગેંગ મજુર	તમામ ખાતાની ઇલેક્ટ્રીકલ, મિકેનીકલ મશીનરી તથા કલોરીન મશીનરીની પ્રિવેન્ટીવ, રૂટીન તથા બ્રેકડાઉન રીપેરીંગ કામગીરી કરવાની ગેંગની સાથે રહી સુચના મુજબની મજુરીની કામગીરી.
૪૩	કલોરીન સુપરવાઈઝર	કલોરીન યુનિટની જાળવણી તથા મેઈન્ટેનન્સ સર્વિસને લગતી કામગીરી

- (૩) દેખરેખ અને જવાબદારનાં માધ્યમ સહિત નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસારની માહિતી :
ખાતાની કામગીરીનાં અનુસંધાને જે તે સક્ષમ સત્તાની મંજુરી મેળવીને નિર્ણય લેવામાં આવે છે.
- (૪) પોતાનાં કાર્યો બજાવવા માટે નક્કી કરેલાં ધોરણો :
જે તે કામગીરી માટે સક્ષમ સત્તાની જરૂરી મંજુરી મુજબ તુમાર અને ફાઈલોનો નિકાલ કરવામાં આવે છે.
- (૫) પોતાનાં કાર્યો બજાવવા માટે પોતાની પાસેનાં અથવા પોતાનાં નિયંત્રણ હેઠળનાં અથવા પોતાનાં કર્મચારીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતાં નિયમો, વિનિયમો, સુચનાઓ, નિયમ સંગ્રહો અને રેકર્ડ :
અમદાવાદ ભૂનિસિપલ કોપોરિશનનાં નીતિ-નિયમો તથા બોઝે પ્રોવિન્સીયલ ભૂનિસિપલ એક્ટ-૧૯૪૮ ની જોગવાઈઓ મુજબની કાર્યવાહી કરવામાં આવે છે.
- (૬) પોતાની પાસે અથવા પોતાનાં નિયંત્રણ હેઠળ હોય તેવાં દસ્તાવેજોનાં વર્ગોનું પત્રક :
લાઈટ ખાતાનાં વર્ગ-૩ અને વર્ગ-૪ માં જુદા જુદા હોક્સ હેઠળનાં કેટેગરી વાઈજ કર્મચારીઓ/અધિકારીઓની સર્વિસબુક, પગારનાં પત્રકો તથા તેને લગતાં આનુષાંગિક રેકર્ડ નિભાવવામાં આવે છે.
- (૭) તેની નિતી અથવા તેનાં અમલીકરણનાં ઘડતર સંબંધમાં જનતાનાં સભ્યો સાથે વિચાર વિનિમય માટે અથવા તેમના દ્વારા રજૂઆત માટેની વિધમાન ગોઠવણીની વિગતો :
આ બાબત આ વિભાગને લાગુ પડતી નથી.
- (૮) તેનાં ભાગ તરીકે અથવા તેની સલાહમાં હેતુ માટે બે અથવા તેથી વધુ વ્યક્તિઓનાં બનેલાં બોર્ડ કાઉન્સીલો, સમિતિઓ અને બીજાં મંડળોની બેઠકો લોકો માટે ખુલ્લી છે કે કેમ અથવા તેની બેઠકોની કાર્યનોથી લોકોને મળવાપાત્ર છે કે કેમ :
આ બાબત આ વિભાગને લાગુ પડતી નથી.
- (૯) તેનાં અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી પુસ્તિકા :
અમદાવાદ ભૂનિસિપલ કોપોરિશન મારફતે દર વર્ષે બહાર પાડવામાં આવતી ડાયરીમાં અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી આપવામાં આવે છે. આ ઉપરાંત સદર ડાયરીની સોફ્ટકોપી અમદાવાદ ભૂનિસિપલ કોપોરિશનની વેબસાઈટ www.ahmedabadcity.org પર મુકવામાં આવે છે. જેમાં દર વર્ષે અમદાવાદ ભૂનિસિપલ કોપોરિશન દ્વારા બહાર પાડવામાં આવતી ડાયરીમાં અગત્યનાં ટેલીફોન નંબરોનો સમાવેશ કરવામાં આવે છે.

(૧૦) તેનાં વિનિયમોમાં જોગવાઈ કર્યા પ્રમાણે વળતરની પદ્ધતિ સહિત તેનાં દરેક અધિકારીઓ અને મળતાં માસિક વળતર :

ક્રમ	હોદ્દો	ગ્રેડ	પે બેન્ડ
૧	ચીફ એન્જિનીયર	૩૭૪૦૦-૬૭૦૦૦	૮૭૦૦
૨	એડી. સી. ઈ.	૩૭૪૦૦-૬૭૦૦૦	૮૭૦૦
૩	ટી.સી.ઇ.	૧૫૬૦૦-૩૮૧૦૦	૬૬૦૦
૪	આ.સી.ઇ.	૮૩૦૦-૩૪૮૦૦	૫૪૦૦
૫	આસી.ઇજનેર	૮૩૦૦-૩૪૮૦૦	૪૬૦૦
૬	ટેક.સુપરવાઈઝર	૫૨૦૦-૨૦૨૦૦	૨૮૦૦
૭	સ્ટ્રીટલાઈટ ઈસ્પે.	૫૨૦૦-૨૦૨૦૦	૨૪૦૦
૮	લીફ્ટમેન	૫૨૦૦-૨૦૨૦૦	૧૬૫૦
૯	ઇલેક્ટ્રીશયન	૫૨૦૦-૨૦૨૦૦	૨૪૦૦
૧૦	ટેલી. ઓપરેટર	૫૨૦૦-૨૦૨૦૦	૨૪૦૦
૧૧	રીસે.કમ ટેલી.ઓપરેટર	૫૨૦૦-૨૦૨૦૦	૧૬૦૦
૧૨	આસી. મેનેજર	૮૩૦૦-૩૪૮૦૦	૫૪૦૦
૧૩	ઓફિસ સુપ્રીટેન્નટ	૮૩૦૦-૩૪૮૦૦	૪૬૦૦
૧૪	અન્ડાન્ડાન્ડ	૮૩૦૦-૩૪૮૦૦	૪૨૦૦
૧૫	હેડ કલાર્ક	૮૩૦૦-૩૪૮૦૦	૪૨૦૦
૧૬	સીની. કલાર્ક	૫૨૦૦-૨૦૨૦૦	૨૪૦૦
૧૭	જુની.કલાર્ક	૫૨૦૦-૨૦૨૦૦	૧૬૦૦
૧૮	પટાવાળા	૪૪૪૦-૭૪૪૦	૧૩૦૦
૧૯	સ્ટોર કિપર	૫૨૦૦-૨૦૨૦૦	૨૮૦૦
૨૦	સ્ટોર સુપરવાઈઝર	૫૨૦૦-૨૦૨૦૦	૧૬૦૦
૨૧	ટાઈપીસ્ટ કમ કલાર્ક	૫૨૦૦-૨૦૨૦૦	૨૪૦૦
૨૨	સ્ટેનોગ્રાફર	૮૩૦૦-૩૪૮૦૦	૪૨૦૦
૨૩	સીની. ચાર્જમેન	૫૨૦૦-૨૦૨૦૦	૨૮૦૦
૨૪	જુની. ચાર્જમેન	૫૨૦૦-૨૦૨૦૦	૨૪૦૦
૨૫	માટર ઇસ્પેક્ટર	૫૨૦૦-૨૦૨૦૦	૨૪૦૦
૨૬	રેફીજરેશન મીકેનીક	૫૨૦૦-૨૦૨૦૦	૨૪૦૦
૨૭	સીની. રેશી.ફીટર	૫૨૦૦-૨૦૨૦૦	૨૪૦૦
૨૮	સુપ. કમ વક્ફેન	૫૨૦૦-૨૦૨૦૦	૧૬૦૦
૨૯	પોકઅપવાન ડ્રાઇવર	૫૨૦૦-૨૦૨૦૦	૧૬૦૦
૩૦	ડ્રાઇવર	૫૨૦૦-૨૦૨૦૦	૧૬૦૦
૩૧	રીશા ડ્રાઇવર	૫૨૦૦-૨૦૨૦૦	૧૬૦૦
૩૨	પંપ અને વાયરમેન એટેન્ડ	૫૨૦૦-૨૦૨૦૦	૧૬૦૦
૩૩	વાયરમેન	૫૨૦૦-૨૦૨૦૦	૧૬૦૦
૩૪	મીકેનીક	૫૨૦૦-૨૦૨૦૦	૧૬૦૦
૩૫	જુની. રેફરી. ફીટર	૫૨૦૦-૨૦૨૦૦	૧૬૦૦
૩૬	ફીટર	૫૨૦૦-૨૦૨૦૦	૧૬૦૦
૩૭	પંપમેન	૪૪૪૦-૭૪૪૦	૧૬૫૦
૩૮	નાયક	૪૪૪૦-૭૪૪૦	૧૬૫૦
૩૯	આસી. મીકેનીક	૪૪૪૦-૭૪૪૦	૧૬૫૦
૪૦	વાયરમેન હેલ્પર	૪૪૪૦-૭૪૪૦	૧૬૫૦
૪૧	ફીટર હેલ્પર	૪૪૪૦-૭૪૪૦	૧૬૫૦
૪૨	ગેગ મજૂર	૪૪૪૦-૭૪૪૦	૧૩૦૦
૪૩	કલોરીન સુપરવાઈઝર	૫૨૦૦-૨૦૨૦૦	૧૬૦૦

(૧૧) તમામ યોજનાઓ સૂચિત ખર્ચ અને કરેલી વહેચણી પરનાં અહેવાલોની વિગતો દર્શાવતું અંદાજપત્ર :
 સદર માહિતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ
www.ahmedabadcity.org અને વર્ષ ૨૦૧૫-૧૬ નાં અંદાજપત્રમાં મુકવામાં આવેલ છે.

(૧૨) ફાળવેલ રકમ અને એવા કાર્યક્રમોનાં લાભાર્થીઓની વિગતો સહિત આર્થિક સહાય કાર્યક્રમોની અમલ બજવણીની રીત :

આ બાબત આ વિભાગને લાગુ પડતી નથી.

(૧૩) આપેલ છુટછાટો, પરવાનગીઓ અથવા અધિકૃતિઓ મેળવનારાની વિગતો :

આ બાબત આ વિભાગને લાગુ પડતી નથી.

(૧૪) ઈલેક્ટ્રોનીક સ્વરૂપમાં તેને ઉપલબ્ધ અથવા તેને ધરાવેલ માહિતીને લગતી વિગતો :

સદર માહિતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ
www.ahmedabadcity.org અતેના ખાતાને લગતી માહિતી, અગત્યનાં ટેલીફોન નંબરો તથા વર્ષ ૨૦૧૫-૧૬ નાં અંદાજપત્ર તથા બીજી અગત્યની માહિતી ઉપલબ્ધ છે.

(૧૫) જાહેર ઉપયોગ માટે નિભાવવમાં આવતાં હોય તેવા ગ્રંથપાલ અથવા તેનાં વાંચનાલયનાં કામકાજનાં કલાકો સહિતની માહિતી મેળવવા માટે નાગરિકોને ઉપલબ્ધ સુવિધાઓની વિગતો :

આ બાબત આ વિભાગને લાગુ પડતી નથી.

(૧૬) જાહેર માહિતી અધિકારીઓનાં નામ, હોદાઓ અને બીજી વિગતો :

ક્રમ	અધિકારીનું નામ અને હોદ્દો	ફરજનો સમય	ફરજનું સ્થળ	સંપર્ક નંબર
૧	શ્રી મહેન્દ્ર એચ. નિનામા એડી. ચીફ એન્જિનીયર અને અપીલ અધિકારીશ્રી (લાઈટ)	સવારે ૮ થી ૧૨ સાંજે ૨ થી ૬	“શી”-બ્લોક, પાંચમો માળ, સરદાર પટેલ ભવન, દાખાપીઠ, અમદાવાદ	M -૯૮૭૪૫૧૪૩૮૧ O -૦૭૯૨૫૩૮૧૮૧૧
૨	શ્રી હિપક એચ. સુથાર ઝ. ચીફ એન્જિનીયર અને અપીલ અધિકારીશ્રી (સ્ટ્રીટલાઇટ/પ્રોજેક્ટ)	સવારે ૮ થી ૧૨ સાંજે ૨ થી ૬	“શી”-બ્લોક, પાંચમો માળ, સરદાર પટેલ ભવન, દાખાપીઠ, અમદાવાદ	M -૯૮૨૮૧૯૭૫૪૩ O -૦૭૯૨૫૩૫૧૮૩૨
૩	શ્રી વાય. યુ. પ્રભાકર ઝ. સીટી એન્જિનીયર અને જાહેર માહિતી અધિકારીશ્રી (ઇલેક્ટ-૧)	સવારે ૮ થી ૧૨ સાંજે ૨ થી ૬	“શી”-બ્લોક, પાંચમો માળ, સરદાર પટેલ ભવન, દાખાપીઠ, અમદાવાદ	M -૯૮૨૭૫૫૪૮૦૨ O -૦૭૯૨૫૩૮૧૮૧૧
૪	શ્રી એ.એ.મલ ઝ. સીટી એન્જિનીયર અને જાહેર માહિતી અધિકારીશ્રી (ઇલેક્ટ-૨)	સવારે ૮ થી ૧૨ સાંજે ૨ થી ૬	“શી”-બ્લોક, પાંચમો માળ, સરદાર પટેલ ભવન, દાખાપીઠ, અમદાવાદ	M -૯૮૬૦૧૭૫૬૫ O -૦૭૯૨૫૩૮૧૮૧૧
૫	શ્રી એમ.યુ. પાવાગઢી ઝ. સીટી એન્જિનીયર અને જાહેર માહિતી અધિકારીશ્રી (ઇલેક્ટ-૩)	સવારે ૮ થી ૧૨ સાંજે ૨ થી ૬	“શી”-બ્લોક, પાંચમો માળ, સરદાર પટેલ ભવન, દાખાપીઠ, અમદાવાદ	M -૯૮૨૭૦૩૮૭૮૧ O -૦૭૯૨૫૩૮૧૮૧૧
૬	શ્રી કંતિભાઈ ડાની આસી. મેનેજર અને જાહેર માહિતી અધિકારીશ્રી (વહીવટી બાબત)	સવારે ૧૦:૩૦ થી સાંજના ૬:૧૦ સુધી	“શી”-બ્લોક, પાંચમો માળ, સરદાર પટેલ ભવન, દાખાપીઠ, અમદાવાદ	M -૯૮૨૭૫૫૪૮૦૮

(૧૭) ઠરાવવામાં આવે તેવી બીજી માહિતી :

નથી.

એનેક્ષર-એ

(સામાન્ય વહીવટ વિભાગનાં તા. ૧-૫-૨૦૦૮ ના પરિપત્ર ક્રમાંક-પીએડી-૧૦-૨૦૦૭-૩૩૫૪૬૪-આરટીઆઈસેલનું બિડાણ)

પ્રમાણપત્ર

આથી પ્રમાણ પત્ર આપવામાં આવે છે કે લાઇટ વિભાગના જાહેર સત્તામંડળ દ્વારા માહિતી અધિકારી અધિનિયમની કલમ ૪ (૧) (ખ) અંતર્ગત સ્વચંમ જાહેર કરવાની બાબતો - પ્રોએક્ટિવ ડિસ્કલોગર (પીએડી) તૈયાર કરવામાં આવેલ છે.

જે તા.૦૧.૦૮.૨૦૧૬ ની સ્થિતીએ અદ્યતન કરવામાં આવેલ છે. જેનું અમારા દ્વારા ઈન્સપેક્શન કમ ઓડિટ કરવામાં આવેલ છે અને જે બાબતે અપુરતી વિગતો જણાઈ હતી તેની પુર્તી કરાવવામાં આવેલ છે.

તા.૦૧.૦૮.૨૦૧૬

એડી. ચીફ એન્જીનીયર
(લાઇટ)

મુખ્ય મથક - અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન,
સરદાર પટેલ ભવન, સી-લોક, પાંચમો માળ,
દાણાપીઠ, ખમાસા રોડ, અમદાવાદ

કચેરીનું નામ -લાઇટ ખાતું

પ્રતિ,
જાહેર માહિતી અધિકારી અને એસેસર અને ટેક્સ કલેક્ટરશ્રી,
આર.ટી.આઈ. સેલ વિભાગ
સરદાર પટેલ ભવન, દાણાપીઠ, અમદાવાદ

વિષય : માહિતી (મેળવવાના) અધિકાર અધિનિયમ ૨૦૦૫ અન્વયે પ્રો-એક્ટિવ ડીસ્કલોઝર
(વર્ષ ૨૦૧૬-૧૭) ની માહિતી બાબત....

સંદર્ભ : (૧) આર.ટી.આઈ. સરક્યુલર નંબર-૦૧, તા. ૨૫-૦૪-૨૦૧૬.
(૨) આર.ટી.આઈ. સરક્યુલર નંબર-૦૨, તા. ૧૦-૦૬-૨૦૧૬.
(૩) લાઈટ ખાતા ઈન્વર્ડ નંબર ઉ૨૫૬ તા. ૦૭-૦૭-૨૦૧૬.

શ્રીમાન,

ઉપરોક્ત વિષય તથા સંદર્ભના અનુસંધાને લાઈટ ખાતાની વર્ષ ૨૦૧૬-૧૭ માટે જાહેર
માહિતી અધિનિયમ ૨૦૦૫ ની કલમ ૪(૧) અન્વયેની જાહેર માહિતી તૈયાર કરવામાં આવેલ છે, જે આ સાથે
સામેલ છે, તો સદરણું માહિતીને જાહેર માહિતી અધિનિયમ હેઠળ આગળની આનુષ્ઠાનિક કાર્યવાહી થઈ આવવા
રખાવી લેવા વિનંતી સહ.

ઓ.એસ.	આસી.મેનેજર	એડી. ચીફ એન્જીનીયર	એડી.ચીફ એન્જીનીયર
	(લાઈટ)	(સ્ટ્રીટલાઈટ/પ્રોજેક્ટ)	(લાઈટ)